



RAN-2501001205037703

B. A. (Sem. - V) Examination October - 2025 Economics (Paper - XVII) Managerial Economics

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (ગમે તે પાંચ) (10)
1. સંચાલકીય અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર જણાવો.
 2. સંચાલકીય અર્થશાસ્ત્રીના કાર્યો જણાવો.
 3. સમય પરિપેક્ષ્યનો ખ્યાલ સમજાવો.
 4. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિઓ જણાવો.
 5. માંગની આગાહીની સારી પદ્ધતિના ધોરણો જણાવો.
 6. પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત જણાવો.
 7. ઉત્પાદન વિધેય લખો.
- પ્ર. 2. માંગની મૂલ્યસાપેક્ષતા એટલે શું? તેને અસર કરતા પરિબળો ચર્ચો. (13)
- અથવા
- પ્ર. 2. અ. સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણો સમજાવો. (07)
- બ. નિર્ણયીકરણ અને ભાવિ-આયોજનનો ખ્યાલ સમજાવો. (06)
- પ્ર. 3. ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ખર્ચ અને ઉત્પાદનના સંબંધો આકૃતિની મદદથી સમજાવો. (13)
- અથવા
- પ્ર. 3. અ. નવી પેદાશો માટેની માંગની આગાહી (07)
- બ. પુરવઠાનો નિયમ સમજાવો. (06)
- પ્ર. 4. ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (14)
1. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ
 2. માંગ આગાહીના પ્રકારો
 3. ઉત્પાદનના નિયમો
 4. કદના ગેરલાભો

ENGLISH VERSION

- Q. 1. Answer the following questions in Brief. (Any five) (10)
1. State the field of study of managerial economics.
 2. State the functions of a managerial economist.

3. Explain the concept of time perspective.
4. State the methods of measuring the price elasticity of demand.
5. State the criteria for a good method of demand forecasting.
6. State the difference between supply and quantity.
7. Write the production function.

Q. 2. What is price elasticity of demand? Discuss the factors affecting it. (13)

OR

Q.2. A. Explain the features of managerial economics. (06)

B. Expand the concept of decision making and future planning. (07)

Q. 3. Explain the relationship between cost and output in the short run and the long run with the help of a diagram. (13)

OR

Q. 3. A. The demand forecasting for new products (06)

B. Explain the law of supply (07)

Q. 4. Write short notes. (Any two) (14)

1. The concept of cross elasticity of demand
 2. The types of demand forecasting
 3. The law of production
 4. That is disadvantages of size
-